


SHAH N. H. COMMERCE COLLEGE, VALSAD

Examination (પરીક્ષા) : <u>F.Y.B.com</u>			Sr. No. : (અ.નં.) :	
SEMESTAR : <u>1</u>			Date (તારીખ) : <u>25/11/22</u>	
Subject (વિષય) : <u>Financial Accounting - 1</u>		CENTRE : VALSAD (કેન્દ્ર) : વલસાડ		
Paper (પ્રશ્નપત્ર) :		Candidate's Seat No. : (પરીક્ષાર્થીનો બેઠક નંબર) :		
Subject Code :		(Digit) (અંકોમાં)		
Packet No. :		(Words) (શબ્દોમાં) <u>Zero / Zero / Zero / Three / Three / One</u>		
Dummy No. :		Answered in : <u>Gujarati / English</u>		
Main	Supplementary (પુરવણી)	Total (કુલ)	Supervisor's Signature	
1	+	2		

Subject code : Packet No. : Dummy No. :

IIIrd Assessment

Que. No.	Marks
I	
II	
III	
IV	
V	
VI	
VII	
VIII	
IX	
X	
Total	
(in words) :	

IInd Assessment

Que. No.	Marks
I	
II	
III	
IV	
V	
VI	
VII	
VIII	
IX	
X	
Total	
(in words) :	

Ist Assessment

Que. No.	Marks
I	
II	
III	
IV	
V	
VI	
VII	
VIII	
IX	
X	
Total	
(in words) :	

Original

Que. No.	Marks
I	09
II	11
III	-
IV	08
V	-
VI	04
VII	
VIII	
IX	
X	
Total	32
(in words) : <u>three two</u>	



Signature of the Examiner

Total After Moderation

in digit in words

Signature of the Examiner

Signature of the Examiner

Signature of the Examiner

Signature of the Moderator

09

8.

[૫.૩] જવાબ

3.

ચોખ્ખી મિલકતની ગણતરી

વિગત

રકમ

મિલકતો

પરચુરા મિલકતો ($20000 \times 10\% = 2000 =$) 22000

અનામત રૂપિયા 2000

ઓવરડ્રાફ્ટ 1000

અ.કિં. 25,000

4]

દરજ મિલકત

અદરજ મિલકત

અવગણવાલુ મિલકત

✓ હોરહાંખર

✓ પેટરજ

✓ વિકાસખર્ચ

✓ ફર્નિચર

✓ ટ્રેડમાર્ક

✓ બાંચધરી કમિશન

✓ પાઘડી

✓ મહેરાત ઉપલક

ખાતું

02

5]

વિગત

મુખ્ય મથાળા

પેરા મથાળું

2. ✓ GBI ની ટૂંકા ગણતરી લોન

✓ ચાલુ મિલકત

ટૂંકા ગણતરી લોન-ધિરાણ

✓ 2. હોરહાંખર

મિલકત મિલકત

દરજ કાયમી મિલકત

6

પેટારોકડ ખાતે

૦૧

વિગત	રકમ	વિગત	રકમ
બાકી આગળ લાવ્યા	1000	પરચુરા ખર્ચ (?)	4800
મુખ્ય ઓફિસ પાસેથી મેલેન સેક પેટારોકડ	5000	બાકી આગળ લઈ ગયા	1200
	<u>6000</u>		<u>6000</u>

આમ નોંધ

7

પેટારોકડ ખાતે

૦૨

વિગત	રકમ	વિગત	રકમ
બાકી આગળ લાવ્યા	1620	પરચુરા ખર્ચ	7074
મુખ્ય ઓફિસ પાસેથી મેલેન પેટારોકડ (?)	13635	બાકી આગળ લઈ ગયા	8181
	<u>15255</u>		<u>15255</u>

૪ ઈ. શેર ૨,૫૦,૦૦૦
(૨,૫૦,૦૦૦ × ૧૦)

૧/૫ ભાગના શેર ૫૦,૦૦૦
(૨,૫૦,૦૦૦ × ૧/૫)

- વરિયા ૧૦% ૫૦,૦૦૦
(૨,૫૦,૦૦૦ × ૧૦%)

૪૫,૦૦૦

આમંતોષ

શેડ્ડ ખાતે ૩ ૪૫,૦૦૦

મા.મિ. બિ. ખાતે ૩ ૫,૦૦૦

તે ઈ. શેર ખાતે ૫,૦૦૦

૧૦. રૂચક કાયદા મિલકતો :

વિગત રકમ

જમીન - મકાન ૨,૫૦,૦૦૦

ફર્નિચર ૬૦,૦૦૦

ચંડો ૨૦૦,૦૦૦

૫૧૦,૦૦૦

2 ચોખ્ખી મિલકતની પદ્ધતિ:

→ આ પદ્ધતિમાં હુલ મિલકતો માંગ્યા હુલ દેવા બાદ કરી ખરીદકિંમત બોધવામાં આવે છે.

→ આ પદ્ધતિમાં જે વેચી અમલકા કંપની પાછાડીની રકમ ચૂકવવા માંગતી હોય તો બાદકિંમત રકમ મિલકતમાં ઉમેરવામાં આવે છે.

ચોખ્ખી મિલકતની ગણતરીનું સૂત્ર :-

(૧) ખરીદ કિંમત = લીધેલ મિલકતો - લીધેલ દેવાં

→ કંપની અવેજ એટલે કે ઈ. શેર, ડિવિડન્ડ અને બાકીની ચેકડ એવું કશું હોય તો ખરીદ કિંમત માખી ઈ. શેર અને ડિ. બાદ થશે. ત્યારે ચોખ્ખી

4. સ્ટોક અને દેવાદાર પદ્ધતિ

→ સ્ટોક-દેવાદાર પદ્ધતિમાં શાખા ખાતા ઉપરાંત બીજા ખાતા પણ બનાવવામાં આવે છે જેમ કે પેયરોક્ડ, દેવાદાર ખાતું વગેરે.

- ૧) શાખાનું સ્ટોક ખાતું
- ૨) શાખાને મોકલેલ મોકલેલ માલનું ખાતું
- ૩) શાખાનું પેયરોક્ડ ખાતું
- ૪) શાખાનું દેવાદાર ખાતું
- ૫) શાખાના ખર્ચનું ખાતું
- ૬) શાખાનું ગફા-ગુફાનું ખાતું
- ૭) શાખાનું રવાના ખાતું

૨) શાખાનું સ્ટોક ખાતું :

→ શાખાનું સ્ટોક ખાતું શાખાના વેપાર ખાતા વેળે વે હોય છે. તેમાં જ ખાતાની ઉદારવાજ શરૂ સ્ટોક અને શાખાને મોકલેલ માલ અંગેની નોંધ વાચ છે અને જમા આવેલ રોકડ વેચાણ, ઉદાર વેચાણ, વેચાણ પરત, શાખાએ પરત કરેલ માલ અંગેની નોંધ વાચ છે.

૨) શાખાને મોકલેલ માલનું ખાતું :-

→ આ ખાતામાં જ્યારે ભરતિયા કિંમત આપેલી હોય ત્યારે શાખાને મોકલેલ માલ તફાવત ખાતાની જમા ખાતું અને શાખાએ પરત કરેલ માલ તફાવત ઉદાર ખાતું નોંધાય છે.

૩) શાખાળ પરચૂરાળ ખર્ચે ખાળું

→ શા ખાતામાં પરચૂરાળની શરૂઆત અને
આ બાકી ઉધાર અને આખરના બાકી
જમા બાજુ નોંધાય છે. આ મુખ્ય સોફિસે
મોડલેસ પેયરોફ ખાતાની ઉધાર બાજુ નોંધાય
છે. અને પરચૂરાળ ખર્ચે શોધવામાં આવે છે
પરચૂરાળની ખર્ચે બીજી નોંધ રૂપખાતા નફા-ગુફાનમાં
કરવામાં આવે છે.

૪) શાખાળ દેવદાર ખાળું

→ શા ખાતામાં શરૂઆતના દેવદાર અને
ઉધાર વેચાળ ઉધાર બાજુ નોંધાય છે
અને દેવદાર પાસેથી મળેલ રોકડ,
આપેલ વરવ દાલખાધ, અને આખરના
દેવદાર જમા બાજુ દર્શાવાય છે.

૫) શાખાળ નફા-ગુફાન ખાળું

→ શા ખાતામાં હાથે નફો જમા બાજુ
દર્શાવાય છે અને ઉધાર બાજુ ખર્ચે
દર્શાવી સોખી ખોર કે સોખી નફો
શોધવામાં આવે છે.

11

પ્ર. 2

CSR લિ. નં. વા. 31-3-2020 ના રોજન
પરિશિષ્ટ 3 મુજબનું પાલુ સરવૈયું

વિગત		નોં. 254
I	ઈકિવરી અને જવાબદારી	
1	શેરહોલ્ડર્સના ભંડોળ	
2	(અ) શેરમૂડી	2 10,25,000
	(બ) અનામત અને વધારો	2 2,07,500
2	ખિતચાલુ જવાબદારી	
	(અ) ભાંખા ગાવાના ઉછીના ભાખા	
	(બ) અન્ય ભંખા ગાવાની જવાબદારી	
	(ક) ભાંખા ગાવાની જોગવાઈ	
3	ચાલુ જવાબદારી :	
	(અ) ફેડા ગાવાના ઉછીના ભાખા	3 37500
	(બ) વેપારી દેવો	3 84,250
	(ક) અન્ય ચાલુ દેવો	
	(ડ) ફેડા ગાવાની જોગવાઈ	3 13275
II	મિલકતો	
1	ખિત ચાલુ મિલકતો	
	(અ) કાયમી મિલકતો	
	i] રૂશ્ય મિલકતો	4 11,40,000
	ii] અરૂશ્ય મિલકતો	5 41,625
	(બ) ખિતચાલુ રાસીયો	6 13
	(ક) જ ભાંખા ગાવાની લોન-દિરાલ	7 1,22,500
	(ડ) અન્ય ખિતચાલુ મિલકત	

વિગત		નોંધ રકમ
2	ચાલુ મિલકતો	
(અ)	ચાલુ રોકાણો	
(બ)	માલ સામગ્રી	6 13,15,000
(ક)	વેપારી લેણા	95,000
(ડ)	મજૂર ચેક અને ચેક સમકલ્પ	11,500
(ઈ)	ટૂંકા ગાળાનો લોન દિરાણ	
(ઈ)	અન્ય ચાલુ મિલકતો (અદરજાતિય)	15,000

નોંધ - 1 ચોરમુડી

ઈક્વિટી ચોરમુડી

7,50,000

8% પ્રેફરન્સ ચોરમુડી

2,75,000

10,25,000

નોંધ - 2 અનામત અને વધારો

સાં

સામાન્ય અનામત

2,07,500

કર્મચારી ફન્ડાઇઝેશન ફંડ

42,500

નોંધ - 3

2,50,000

નોંધ - 3 વેપારી દેવ

લેણદારો

70,000

+ દેવીફંડી

14,250

84,250

નોંધ - 4 દરખ મિલકતો

ચંત્રો

9,00,000

ઓફિસ સાધનો

2,40,300

11,40,300